

દુક્મેહુકૂમ

કરમત નવ્હતે મહણુંનિ એકદા અસાચ ગેલો રાની
વસંત કા - પરિ ઋતુ દુસરા કથિ કુણી પાછિલા કવની?

સમોર હોતા જ્ઞાડાવરતી એક ચિમુકળા પક્ષી
બોળુંનિ ચાલુંનિ કવી પડલો મી - સહજચિ ત્યાલા લક્ષી
વસંત ઋતુ તો, રમ્ય વનહિ તે, પક્ષિ આણિ કવિરાય
તુમ્હીચ સાંગા રસિકા, આતા હવે આણખી કાય?

સત્વર કવિચ્યા રસિકપણાને સાંગિતલે ત્યા ગાયા
નવલ વાટતે સાંગણ્યાપરિ - કી તે ગેલે વાયા
“વૃક્ષાવરચ્યા માઝ્યા મિત્રા, કાહી ગાણે ગાચ
ગમતીર્ખાતર આણિ જરાસા ઇકડેતિકડે નાચ

બંધુ તુજ્ઞા મી - માઝ્યાસાઠી ગડયા લાગ તૂ ગાયા
હે બધ દેતો કણ ધાન્યાચે કાહી તુજલા ખાયા
સ્તુતિ ગાણ્યાચી તુઝ્યા બહુપરી કરિન ચારચૌઘાંત
ચિત્રહી આણિન તુજ્ઞો કરશાચ્યા ખાસ તરી અંકાંત

ગાણ્યાચી યા તુઝ્યા શિફારસ કરું અશી ભરપૂર
કી શાલાખાતેહી વેડયા કરલિંલ તે મંજૂર”
અશા પ્રકારે ફાર નિવિલે જીવ તોડૂની સાચ
મિકારડે તે કાહી કેલ્યા પરંતુ ઐકેનાચ

ગા મહટલ્યા જો ગાત નસે ત્યા સૃષ્ટીચા કવિ મહણતી
મસ્તક ફિરલે હાતપાયહી રાગાને થરથરતી
“એક મારિતો દગડ અસા કી પડેલ વાસુની ચોચ”
મહણુંનિ વાકળો તસાચ સ્રાલી આવેગાને તોચ

लग्बग दिसले स्नेही माझे संपादक त्या ह्याचे
म्हणू लागले, "भले, तुम्हाला कुठे कुठे पाह्याचे?"
या अंकाचा चाळू तक्ता (फर्मा) होत नाहिं भरपूर
कामाचा खोळंबा झाला, घा काही "मजफूर"

वसंत अंकी वसंतवर्णनपर कविता चालेल
परंतु झटदिशी करा नातरी काम उगिच लांबेल
"सरासरी घा खरडुनी ओळी अठरापासुनी वीस"
ऐकले न हे तो कवनाची झाली स्फुर्ति कवीस

झाडावरचा पिसाट कवी तो तसाच टाकुनि रानी
चला रसिकहो लाबी रुंदी नीट ठेवुनी ध्यानी
वसंतकाळी त्या वर्णाया वनातुनी माघारी
गोविंदाग्रज कवीश्वराची घरी परतली स्वारी

गोविंदाग्रज
१०-१२-१९९२

गडकरीच्या प्रतिभेविषयी मी काय सांगणार? त्यांच्या
बाळकरामाने आपल्याला खदखदा हसविले आहे, नाटकातील
पात्रांनी, नाटकाच्या कथानकांनी मनाला हूरहूर लावली आहे
आणि कवितांनी अचंबित केले आहे.

निसर्गकविता बालकवीच्याच इतक्या सहजपणे आणि अकृत्रिमपणे
गडकरीच केवळ लिहू शकले.

त्यांच्या भावनापर विशेषतः दुःखी, निराश भावनेचे चित्रण
असलेल्या कविता आवल्याला विचार करायला भाग पाडतात.

त्यांच्या मनातील कल्पना विद्युत्केगाळे धावत आणि त्यामुळे कधीकधी उपमा, उत्प्रेक्षांचा अती भडिमारही होत असे.

आजची कविता ही माझ्या मते, गडकरीच्या प्रतिभेचा छान आविष्कार आहे. इतका सुन्दर नर्मविनोद कवितेत खूपच क्वचित आढळतो विशेषत: इतक्या जुन्या कवितांमध्ये.

कवितेत वसन्त सोडून दुसरा ऋतू नसणे, पक्ष्याला बघून कवीने त्याला गाण्याची आज्ञा करणे आणि त्याने अपेक्षाभंग केल्यावर त्या पण्याच्या जिवावर उठणे या गोष्टीनन्तर काय होणार ह्याची उक्कंठा वाटते.

तेवढ्यात मासिकाचे संपादक भेटल्यावर तत्परतेने त्याने १८-२० ओळीची कविता पाडायला सुरुवात करणे या गोष्टी मात्र कालातीत आहेत.

मन्दार